

# રીંગાણી આધુનિક ખેતી પદ્ધતિ



પ્રો. ભક્તિ બી. પંચાલ અને ડૉ. કે. એચ. રાઠોડ  
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી,  
અઠવા ફાર્મ, સુરત- ૩૮૫ ૦૦૭  
ફોન નં. ૦૨૬૧- ૨૯૫૫૫૫૫  
પ્રકાશન નંબર: ૧૩૭/૨૦૧૭-૧૮  
પ્રકાશન વર્ષ: ૨૦૧૭-૧૮

## રીંગણાની આધુનિક ખેતી પદ્ધતિ

પ્રો. ભક્તિ બી. પંચાલ અને ડૉ. જે. એચ. રાહોડ  
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ બુનિયાદી, સુરત

રીંગણ એ શાકભાજુનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો સર્વ સામાન્ય અગત્યનો પાક છે. જુદા જુદા પ્રકારનાં શાક બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. મળુષ્યની દરરોજની શાકભાજુની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વધારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. ગુજરાતમાં અમદાવાદ, જેડા, ભર્યા, નવસારી, તાપી, જૂનાગઢ, સુરત અને વલસાડ જિલ્લામાં રીંગણનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે તેની આધુનિક ખેતી પદ્ધતિના વિવિધ પાસાઓની પૂર્તી જાણકારી મેળવવી જરૂરી છે.

### આભોહવા

ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર દરેક અતુ દરમ્યાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે જેથી શિયાળા દરમ્યાન ફેરારોપણી કરવામાં આવે તો વૃદ્ધિ ઝડપથી થતી નથી પરંતુ ઇન બેસવા માટે અને ફળની વૃદ્ધિ માટે ઠંડી અને સૂક્કી આભોહવા વધુ માફક આવે છે. વાદળવાનું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુભૂળ આપવો નથી. ચોમાસામાં દરમ્યાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની પસંદગી કરવી.

### જમીનની પસંદગી અને તૈયારી

રીંગણનો પાક જુદા જુદા પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. રીંગણના પાકને સારી નિતારવાળી, સેન્ક્રિય તત્વથી ભરપૂર એવી બેસર, ગોરાકુ કે મદ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. રીંગણના પાકની રોપણી માટે જમીનની જરૂરિયાત મુજબ ખેડ, કરબ અને સમાર મારી તૈયાર કરવી. પાચાળા ખાતરો અને સાંનું ડોહવાયેલ છાણયું ખાતર ૧૫-૨૦ ટન જમીન તૈયાર કરતી વખતે એકસરખી રીતે જમીનમાં બેળવી દેવા.

### જાતોની પસંદગી

રીંગણના ઉપયોગને દ્યાનમાં રાખીને આપણા વિસ્તાર માટે ભલામણ થયેલ હોય તેવી જાતોની પસંદગી કરવી. આપણા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતી રવૈયા (ગોળ રીંગણ), જાંબુડીયા ગોળ, પુસા પરપલ રાઉન્ડ (ગુલાબી) પુસા પરપલ રાઉન્ડ, બીલીમોરા ભરથા, ડોલી-પ અને જીએનબી-૧ જાતોની ભલામણ કરવામાં આવેલ છે.

### ઘરુંછેર

ઘરુંછેર માટે ગાદી ક્યારા બનાવવા. એક હેક્ટરની ફેરારોપણી માટે ૧૫૦ ચો.મી. (૧.૫ ગુંડા) વિસ્તારમાં ઘરુંછેરયું તૈયાર કરવું જોઈએ આ માટે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. ઘરુંછેરાં ૧૦૦ ફિ સારું કોણાંદ્ર છે. એક કિલો ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા એક કિલો મ્યુરેટ ઓફ પોટાશ જમીન તૈયાર કરતી વખતે નાંખી માટી સાથે બરાબર બેળવી ગાદી ક્યારા તૈયાર કરવા. તૈયાર કરેલ ગાદી ક્યારામાં ૧૦ સે.મી.ના અંતરે છીછરા ચાસ ઉગાડવા અને ચાસમાં આછું બીજ હારમાં

વાયા પછી ઝીણી માટીથી બરાબર છાંકું. શેખ્યા બાદ ઘરવાડિયામાં જરૂરીયાત મુજબ પાણી આપવું અને પાક સંરક્ષણાના પગલા લેવા. ધર્મ ૩૦-૩૫ દિવસનું થાય ત્યારે ફેરશોપણી કરવી.

## બીજની પસંદગી અને બીજની વાવણી

પસંદગીની જાતનું, ખાતરી વાળું શુદ્ધ, વિકાસ પામેલ અને પુરતી સ્કરણ શક્તિવાળું (૭૦ ટકા થી વધારે) બીજની પસંદગી કરવી. શાકભાજીના પાકોની ફેરશોપણી માટે જરૂરીયાત કરતા ૧૫ થી ૨૦ ટકા વધારાના ધર્મ છોડ તૈયાર કરવા જોઈએ. બીજ જન્ય રોગના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલાં પારાયુક્ત દવાનો પટ આપવો. આ માટે ૧ ડિગ્રા. બીજમાં ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા સેરેસાન નાખી બરાબર બેળવી દેવું.

બીજ દર (કિલો / હે) : ૪૦૦ ગ્રામ (૧૫-૧૮ હજાર છોડ)

## ઘરભાવજત

ધર્મ રોપતા પહેલાં મૂળિયાને ઇમિડાકલોપ્રિડ ૫ મિ. લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી તેમાં અડદો કલાક બોળીને ફેરશોપણી કરવી.

## વાવણી અંતર અને ફેરશોપણી

ફેરશોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીગણાની જાત જીવિનની ફળકૃપતા અને સીક્રનને દ્યાનમાં રાખીને ૩૦ થી ૩૫ દિવસના ધર્મને ૮૦ સે.મી. × ૫૦ સે.મી. અથવા ૮૦ સે.મી. × ૪૫ સે.મી. ના અંતરે જીસલી ખેંચીને દરેક થાળો એક છોડની રોપણી કરવી., સામાન્ય રીતે ચોમાસું પાકની ફેર રોપણી જુલાઈ માસમાં, શ્રીયાળું પાકની ઓક્ટોબર-નવેમ્બર અને ઉનાળું પાકની ફેરશોપણી ફેલ્બુઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે. ૨૫ક પિયત પદ્ધતિ અપનાવતા ખેડુતોએ જોડિયા હાર (૫૦ સે.મી. × ૫૦ સે.મી. × ૧૨૦ સે.મી.) માં વાવેતર કરવું.

## ખાતર

જીવિન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ ૧૫-૨૦ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર આપવું. પાચાના ખાતર તરીકી રોપણી પહેલા જીવિન તૈયારીના સમયે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરે દરેક ૫૦ ડિગ્રા. પ્રમાણે હેક્ટર વિસ્તારમાં આપવા (૧ ગુઠામાં ૧.૦૮ ડિ.ડી.પી., ૧.૫ પર ડિ એમો. સલ્ફેટ અને ૦.૮૦ ડિ.પોટાશ) પૂર્તિ ખાતર તરીકી રીગણાના પાકમાં ફેરશોપણીના ત્રીજા અઠવાડિએ રૂપ કિલો (૧ ગુઠામાં ૧.૨૫ ડિ એમો. સલ્ફેટ) અને ફલ આવવાના શરૂ થાય તે સમયે ૨૫ કિલો. નાઇટ્રોજન હેક્ટર દીઠ (૧ ગુઠામાં ૧.૨૫ ડિ એમો. સલ્ફેટ) આપવી. રીગણમાં સંકલિત ખાતર વ્યવસ્થા જો અપનાવવામાં આવે તો ધાણું સાલ ઉત્પાદન મેળવી શકાય. જેના માટે ૫ ટન બાયોક્રમ્પોસ્ટ અને ૧૦ ટન પ્રેસમંડ પાચાના ખાતર સાથે આપવું અને ઉપર જગાવેલ રાસાયણિક ખાતરનો ૪૫ ટકા જલથો આપવાથી ધાણું સાલ ઉત્પાદન મેળવી શકાય.

## પિયત

રીગણનાં પાકને ચોમાસા દરમિયાન હવામાન, વરસાદની પરિસ્થિતિ, જીવિનની જાત અને પાકની વૃદ્ધિનાં સમયને દ્યાનમાં રાખીને પિયત આપતા રહેવું. ગુજરાતમાં રીગણમાં પિયત માટે ૨૫ક સિંચાઈ પદ્ધતિનાં ઉપયોગથી ૨૪% પાણીનો બચાવ કરી શકાય છે. ૨૫ક સિંચાઈ પદ્ધતિની ગેરહાજરીમાં સપાઠી પરનું

પિયત ક સે.મી.ના ડાઇએ આપવાની ભલામણ છે. ગુજરાતની કાળી જમીનમાં રીગણના પાકને મલ્ચીંગ સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાપવાની ભલામણ છે જેથી ૪૦% પાણીના બચાવ સાથે, હેક્ટર દીઠ અધ્યક્ષ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. કાળી જમીનમાં વાવવામાં આવતા રીગણના પાકને ૧૨ પિયત આપવાની ભલામણ છે (૮૦ સે.મી. ડાઇ). પહેલું પિયત ફેરોપણી વખતે, પછીના ત્રણ પિયત ૧૦-૧૨ દિવસના અંતરે, પછીના પમું પિયત ૧૫-૧૭ દિવસના અંતરે અને છેલ્લા ૩ પિયત ૨૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે. દક્ષિણ ગુજરાતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવતી સુરતી રવૈયાની મોસમને ૭ પિયત આપવાની ભલામણ છે સાથે સાથે કાળા પલાસ્ટિકના (૫૦ માઇક્રોન, ૧૦૦% આવરીત વિસ્તાર) મલ્ચિંગની ભલામણ છે.

## પાછળી ભાવજત

પાકની શરખાતની અવસ્થાએ જરૂર પ્રમાણે આંતરખેડ અને નિદાંમાણ નિયંત્રણ કરતા રહેલું. રીગણના પાકમાં સપ્રમાણ વૃદ્ધિ અને મહત્વમાં ઉત્પાદન મેળવવા માટે ૪ પી.પી. એમ ૨-૪ ડીના અથવા એન.એ.એ. ૩૫ પી.પી.એમ્સ નોંધંટકાવ ફુલ આપવાના સમયે અને ત્યારબાદ બે છંટકાવ ત્રણ અને ૭૭૭ અઠવાડીએ સવારના સમયે કરવાથી ફળ વહેલા આવે, ફળ ધારણ, ગુણવત્તા વધે અને ઉત્પાદન વધુ મળે છે.

## રીગણની વીણી અને ઉત્પાદન

રીગણની જાત પ્રમાણે ફળોના કદ અને રંગને દ્યાનમાં રાખીને વીણી કરવી. રીગણનાં પાકની ફેરોપણી કર્યા પછી લગભગ અઢી મહિને ફળ ઉતારવા શરૂ થાય છે. અઠવાડીયામાં બે થી ત્રણ વખત રીગણા ઉતારવા જોઈએ. બજારમાં લઈ જતા પહેલાં, વીણી કરેલા ફળો સાછ કરવા, ગ્રેડિંગ કરવું, રોગ અને જીવાતથી નુકશાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્થિત પેકિંગ કરવાથી સારા બજારભાવ મળી રહે છે. આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી રીગણનું વાવેતર કરવામાં આવે તો હેક્ટરે અંદાજે ૩૫ થી ૪૦ હજાર ટન કિલો ઉત્પાદન મેળવી શકાય.

## રીગણનો બડધા પાક

રીગણનો બડધા પાક એવી રીતે લેવો કે મે માસ દરમિયાન આપણાને રીગણનો ઉતારો મળી શકે. આ માટે ફેલ્બુઅારી માસમાં રીગણના છોડની છટળી કરવી.